

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૦૪/૦૪/૨૦૧૮ બુધવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૪૭/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૧૮ કેસ કરી, ૧૭ વ્યક્તિઓને ઝડપી, ૧૭૮ લીટર દેશી દારૂ, ૧૫ બોટલ ઈંગ્લીશ દારૂ, ૦૭ બીયરટીન અને ૧ સ્કુટર કબજે કર્યું હતું તેમજ જુગાર ધારા હેઠળ ૦૪ કેસ કરી ૨૩ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૨,૩૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૬૪૮/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૨૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૧૫ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

લુંટ ની ફરીયાદ :-

સમાચાર યાદી નં.૬૪૯/૧૮

સરદારનગર: સુંદરભાઈ મેઘરાજભાઈ ભાટીયા (ઉ.વ.૪૨)(રહે,ગોગાના મંદીર પાસે, રમેશદત્ત કોલોની ભદ્રેશ્વર સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૩/૦૪/૧૮ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે હાંસોલ તલાવાડી ત્રણ રસ્તા પાસે કોર્સ બાઈટ હોટલ સામે એક અજાણ્યા પુરૂષે સુંદરભાઈ સાથે બોલાચાલી ઝગડો કરી મારામારી કરી સુંદરભાઈની ભાડાની ઓટોરીક્ષા નંબર જીજી.૦૧.ડી.ટી.૪૮૩૩ કિમત રૂપિયા ૫૦,૦૦૦/- લુંટ કરી લઈ ગયો હતો આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૬૫૦/૧૮

ઓઢવ: બળવંત જયંતિભાઈ ભાનુશાલી(રહે,શબરી બંજ્લોઝ મનોહર વિલાની બાજુમા નિકોલ નરોડા રોડ) એ તા.૨૯/૩/૧૮ બપોરના ૨/૦૦ વાગ્યાના સુમારે ઓઢવ ફાયર બ્રિગેડ વેરા પાસે બાલાજી ગેસ્ટ હાઉસની બાજુમાં પોતાની આઈસર ગાડી નંબર જીજી.૦૧.ઇ.ટી.૨૮૫૯ કિમત રૂપિયા ૧૪,૦૦,૦૦૦/- પાર્ક કરી હતી. જેની ચોરી તા.૩/૪/૧૮ કલાક ૧૨/૦૦ વાગ્યા દરમ્યાન થઈ હતી. આ અંગેની ફરીયાદ બળવંત ભાનુશાલીએ તા.૩/૪/૧૮ નારોજ ઓઢવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પલાસ ચલાવે છે.

કેનની ટ્રોલી પડતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૬૫૧/૧૮

નારોલ: મોહસીનખાન શરીફખાન પઠાણ (ઉ.વ.૨૮)(રહે.અલીફનગર વટવા) તા.૦૩/૦૪/૧૮ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે વટવા જીઆઈડીસી ફેઝ-૪ મા આવેલ ફ્લુઈડ લાઈન વાલ્વ ઈન્ટરનેશનલ પ્રા.કંપનીમા નોકરી કરતા હતા દરમ્યાન લેથ મશીન હટાવવા સારૂ હેડ કેનની મદદથી હટાવતા ઉપર થી કેનની ટ્રોલી પડતા, મોહસીનખાનને શરીરે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે તેમને એલ.જી.હોસ્પિટલમા લાવતા ફરજ પરના ડો.શ્રી એ બપોર ના ૧૨/૪૫ વાગે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગુનાની તપાસ મ.સ.ઇ.શ્રી ડાહ્યાભાઈ પન્નાભાઈ ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૬૫૨/૧૮

કૃષ્ણનગર: નિકિતાબહેન સમીરભાઈ તંવર (ઉ.વ.૨૯)(રહે,બી.કે.ટેનામેંટ ગોકુલ-કૃષ્ણા સોસાયટીની બાજુમાં કૃષ્ણનગર) એ કોઈ અગમ્ય કારણોસર તા.૩/૪/૧૮ ના કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી પી.કે.દવેરા ચલાવે છે.

ઓઢવ: કાન્તીદેવી વા/ઓ શૈલેન્દ્ર ઉર્ફે મુખીયા યાદવ (ઉ.વ.૩૦)(રહે,શક્તિનગર સોસાયટી, છેલ્લી લાઈન જનતાનગર ટેકરા સામે મનમોહન ચાર રસ્તા ઓઢવ) એ કોઈ અગમ્ય કારણસર તા.૩/૪/૧૮ સાજના ૬/૩૦ વાગ્યા પહેલા કોઈપણ સમયે પોતાના ઘરે પંખાના હુકમાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે ઓઢવ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.બી.પલાસ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.